

MQ-104

May-2022

B.Ed., Sem.-II**C-02 : Assessment of Learning**

(અધ્યયનનું મૂલ્યાંકન)

Time : 2 Hours]**[Max. Marks : 50**1. નીચે આપેલા પ્રશ્નો પૈકી ગમે તે છ પ્રશ્નોના ઉત્તર આપો : 42

- (1) માપનની વ્યાખ્યા આપી, માપનની કક્ષાઓ ઉદાહરણ સહિત સમજવો.
- (2) મૂલ્યાંકન એટલે શું ? મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો સ્પષ્ટ કરો.
- (3) માપન અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
- (4) ‘ઓનલાઈન પરીક્ષા’નો અર્થ આપી, ઓનલાઈન પરીક્ષાના ફાયદાઓ અને મર્યાદાઓ જાળાવો.
- (5) ખુલ્લા પાઠ્યપુસ્તક સાથે પરીક્ષા વિદ્યાર્થીઓમાં યોગ્ય અધ્યયન ટેવોનો વિકાસ કરે છે – વિધાન સાબિત કરો.
- (6) પ્રવર્તમાન પરીક્ષા પદ્ધતિની સુધારણા માટેના સૂચનો જાળાવો.
- (7) કમ માપદંડ એટલે શું ? કમ માપદંડના પ્રકારો ઉદાહરણ વડે સમજવો.
- (8) ‘આર્થ્ર્યુપ્રશ્નપત્ર’ના લક્ષણો સ્પષ્ટ કરો.
- (9) પ્રમાણિત કસોટીની રચનાના સોપાનો સ્પષ્ટ કરો.
- (10) નીચેની માહિતી પરથી મધ્યકની ગાણતરી કરો :

વર્ગ	0-10	10-20	20-30	30-40	40-50	50-60	60-70
આવૃત્તિ	3	5	12	16	11	5	4

- (11) નીચેની માહિતી પરથી પ્રમાણિત વિચલનની ગાણતરી કરો :

વર્ગ	0-10	10-20	20-30	30-40	40-50	50-60	60-70
આવૃત્તિ	10	15	25	25	10	10	5

- (12) નીચેની માહિતી પરથી P_{70} ની ગાણતરી કરો :

વર્ગ	1-5	6-10	11-15	16-20	21-25	26-30	31-35
આવૃત્તિ	2	5	12	18	12	10	4

2. નીચે આપેલા પ્રશ્નો પૈકી ગમે તે ચાર પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

8

- (1) માપનના પ્રકારો જણાવી દરેક પ્રકારનું એક ઉદાહરણ આપો.
 - (2) ‘મૂલ્યાંકન ત્રિકોણ’ની આકૃતિ દોરો.
 - (3) વર્તમાન પરીક્ષા પદ્ધતિની બે ભર્યાદાઓ જણાવો.
 - (4) સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલપના સ્પષ્ટ કરો.
 - (5) અવલોકનના પ્રકારો જણાવો.
 - (6) વિશ્વસનીયતા અને યથાર્થતા એટલે શું ?
 - (7) મધ્યવર્તી સ્થિતિના માપો જણાવી, મધ્યવર્તી સ્થિતિમાનનું શ્રેષ્ઠ માપ જણાવો.
 - (8) 50 વિદ્યાર્થીઓના વર્ગખંડમાં વિજયનો કમ 3 છે, તો તેનો પ્રતિશત કમાંક શોધો.
-

MQ-104**May-2022****B.Ed., Sem.-II****C-02 : Assessment of Learning****Time : 2 Hours]****[Max. Marks : 50**

1. Answer any **six** from the following questions given below : **42**

- (1) Define measurement and explain the scale of measurement with example.
- (2) What is Evaluation ? Clarify the steps of Evaluation process.
- (3) Clarify the difference between Measurement and Evaluation.
- (4) Give the meaning of ‘Online Examination’, and list out its merits and limitations.
- (5) Justify the statement ‘Open TextBook Examination, develops proper learning habit amongst students’.
- (6) Detail out your suggestions to improvise the Current Examination system.
- (7) What is Rating Scale ? Explain the types of rating scale with example.
- (8) Clarify the characteristics of ‘Ideal Question paper’.
- (9) Clarify the steps of constructing a standardized test.
- (10) Calculate mean of the data given below :

Class	0-10	10-20	20-30	30-40	40-50	50-60	60-70
Frequency	3	5	12	16	11	5	4

- (11) Calculate ‘Standard Deviation’ of the data given below :

Class	0-10	10-20	20-30	30-40	40-50	50-60	60-70
Frequency	10	15	25	25	10	10	5

- (12) Calculate P_{70} of the data given below :

Class	1-5	6-10	11-15	16-20	21-25	26-30	31-35
Frequency	2	5	12	18	12	10	4

2. Answer in short any **four** of the following questions given below : 8

- (1) Give the types of Measurement and give away one example for each.
 - (2) Draw the diagram of ‘Evaluation Triangle’.
 - (3) Give two limitations of contemporary education system.
 - (4) Clarify the concept of continuous and comprehensive evaluation.
 - (5) Give the types of Observation.
 - (6) What is reliability and validity ?
 - (7) State the measurements of central tendency and give the superior measurement of central tendency.
 - (8) Vijay ranks 3rd in the class of 50 students. Find out his percentile rank.
-